

તાત્કાલિક પ્રકાશન માટે

આપણાં શહેરે પંચવર્ષીય ઊર્જા અને ઉત્સર્જન વ્યવસ્થાપન યોજના જાહેર કરી

આ યોજનાનો હેતુ આપણાં શહેરની નવી અને હયાત કોર્પોરેટ સગવડો માટે શૂન્ય કાર્બન સંક્રમણ મેળવવાનો છે.

બ્રમ્પટન, ઓન્ટારિયો (ઓગસ્ટ 29, 2019) – સીટી ઓફ બ્રમ્પટને ઔપચારિક રીતે પોતાની ઊર્જા અને ઉત્સર્જન વ્યવસ્થાપન યોજના વર્ષ 2019-2024: શૂન્ય કાર્બન સંક્રમણ જાહેર કરી.

આ યોજનાનું લક્ષ્ય આગામી પાંચ વર્ષોમાં ત્રણ મહત્વના હેતુઓ વડે, શહેરની નવી અને હયાત કોર્પોરેટ સગવડો માટે શૂન્ય કાર્બન સંક્રમણ હાસલ કરવાનું છે, જેમ કે: ઉત્સર્જન તીવ્રતા ઘટાડવી, ઊર્જા તીવ્રતા ઘટાડવી અને ખર્ચ વસૂલાત મહત્તમ કરવી.

પેરિસ કરાર અનુસાર, બ્રમ્પટને વર્ષ 2010 ને આધારભૂત ગણીને, 2030 માટે 30% અને 2050 માટે 80% પ્રાંતીય અને સંઘીય ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન ઘટાડાના લક્ષ્યો સ્વીકાર્યા છે. આ શહેરે વર્ષ 2024 સુધીમાં 20% જેટલું GHG ઉત્સર્જન ઘટાડાનું વચગાળાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

બ્રમ્પટનના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડાના લક્ષ્યો (2019)

વર્ષ	ઘટાડાનો લક્ષ્યાંક, 2010 નાં સંબંધમાં
2024	20%
2030	30%
2050	80%

વર્ષ 2014 થી 2019 સુધીમાં, આ શહેરે ઊર્જા સંરક્ષણ, નવીનીકરણીય ઊર્જા, ત્રાહિત-પક્ષનું ભંડોળ, ઊર્જા પ્રાપ્તિ અને જળ વળતર મારફતે કુલ \$5.8 મિલિયન ખર્ચની વસૂલાત કરી છે. આ પંચવર્ષીય સમયગાળામાં, આ શહેરે પોતાની સગવડોમાં 13 થી વધારે નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સનું, અને 50 ઊર્જા સંરક્ષણ પ્રોજેક્ટ્સનું અમલીકરણ કર્યું છે.

એક હરિયાળા શહેર તરીકે, બ્રમ્પટન શૂન્ય કાર્બન અને ઉચ્ચ કામગીરી કરતી સગવડો માટે કટિબદ્ધ છે.

સંપૂર્ણ દસ્તાવેજ [અહીં](#) ઉપલબ્ધ છે અને સારાંશ [અહીં](#) ઉપલબ્ધ છે.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રમ્પટન એક હરિયાળુ શહેર છે. અમે સ્થિરતા હાસલ કરવા નિર્મિત પ્રોજેક્ટ્સ મારફતે આપણી કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની અગ્રતા પર ધ્યાન આપીએ છીએ. ઊર્જા અને ઉત્સર્જન વ્યવસ્થાપન યોજના 2019-2024 ન કેવળ પ્રાંતીય અને સંઘીય ઉત્સર્જન લક્ષ્યાંકોને મળતી આવે છે પરંતુ – તે આપણાં સમુદાય માટે સુઘડ, વધારે હરિયાળા ભવિષ્ય માટેના બીજા પગલુ રોપે છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

“બ્રેમ્પટન સીટી કાઉન્સિલે આબોલવા કટોકટીની ઘોષણા કરી છે, જેમાં ટકાઉ ભવિષ્ય માટે આપણી શોધમાં 35 અન્ય નગરપાલિકાઓને જોડી છે. ઊર્જા અને ઉત્સર્જન વ્યવસ્થાપન યોજના 2019-2024 બ્રેમ્પટનમાં ઉત્પન્ન થતા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને વર્ષ 2050 સુધીમાં 80% જેટલા ઘટાડવાના આપણાં લક્ષ્યને હાસલ કરવામાં એક મુખ્ય ચાલક બની રહેશે.”

- પ્રાદેશિક કાઉન્સિલર રોવેના સેન્ટોસ (Rowena Santos), સમુદાય સેવાઓના અધ્યક્ષ

“આપણું શહેર અસરકારક ઊર્જા વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે કટિબદ્ધ છે. ઊર્જા અને ઉત્સર્જન વ્યવસ્થાપન યોજના 2019-2024 વર્ષ 2024 સુધીમાં ઉત્સર્જન ઘટાડાના 20% લક્ષ્યની સાથે સાથે, આપણી સગવડોમાં શૂન્ય કાર્બન સંક્રમણ હાસલ કરવાના આપણાં લક્ષ્યનો પાયો છે. આ એક મહત્વનું સંક્રમણ છે જેની આગેવાની કરવા અમે રોમાંચિત છીએ.”

- અલ મેનેસિસ (Al Meneses), કાર્યકારી મુખ્ય વહીવટી અધિકારી

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca